### **Essen Speciality Films Limited**

Formerly known as Essen Speciality Films Private Limited

Regd. Office Survey No. 192, Plot No. A, Industrial Area, Behind Orchev Pharma, Veraval (Shapar), Rajkot - 360 024 Guiarrat - India

Phone : +91 98253 12701
E-mail : info@essenspeciality.com
Website : www.essenspeciality.com
CIN : L24224GJ2002PLC041119
GSTIN : 24AABCE2983N1ZC



December 04, 2024

To,

#### National Stock Exchange of India Limited

The Listing Department Exchange Plaza, C-1, Block - G, Bandra-Kurla Complex, Bandra (East), Mumbai - 400 051

**NSE Symbol: ESFL** 

Subject: Submission of Newspaper clippings of Notice of Record Date for issue of

**Bonus Equity Shares** 

Reference: Regulation 47 of the Securities and Exchange Board of India (Listing

Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing

Regulations")

Dear Sir/ Madam,

With reference to the captioned subject and pursuant to Regulation 47(1)(d) and 47(3) of SEBI Listing Regulations, please find enclosed copy of newspaper clippings of Notice of Record Date for issue of Bonus Equity Shares which has been published today i.e. Wednesday, December 04, 2024 in following newspapers:

- 1. "Economic Times" English Language Daily
- "Navgujarat Samay" Gujarati Language Daily

Copy of newspaper clippings shall also be available on the website of the Company at <a href="https://www.essenspeciality.com/investorszone.html">https://www.essenspeciality.com/investorszone.html</a>

We request you to kindly take the above information on record.

Thanking You.

Yours Faithfully,

For, ESSEN SPECIALITY FILMS LIMITED

Pallav K. Doshi Chairman and Whole-time Director DIN: 02542047

Encl: a/a

# Everton defender Ashley Young could play against his son when his team takes on Peterborough United

## An emperor's statue gets its head back

A Danish museum agreed that it had been looted and should be returned to Turkev

thought to be likeness of Roman emperor Septimius Severus is to be reunited with its long-lost torso after a Danish museum agreed that its sculpture of a bearded man's head had been looted and should be returned to Turkey.

The torso, which for years remained at the Metropolitan Museum of Art in New York, was returned to Turkey in 2023 after its seizure by investigators who said it had been looted.

Since then, the Turkish government has been petitioning the Ny Carlsberg Glyptotek in Copenhagen, requesting the return of the 2,000-yearold head to complete the statue.

Last week, the Danish museum said its researchers had concluded that the artefact, which has been in its collection since 1970, was likely to have been excavated illegally from Bubon, a site in the southwest of Turkey that investigators say was heavily looted in the 1960s.

Recently found legal

documents that shed new

light on the demise of The

Yoko Ono have all been

blamed for the Fab Four's

break-up, the documents

reveal the numerous

convoluted legal battles

that weighed on the band,

from manager Allen

Klein's inability to produce

accounts for the tax

authorities to deciding when

n ancient bronze Rise and fall of Severus

Severus was a wily general who outmanoeuvred four rivals to assume the emperor's seat, ruling Rome from 193 AD to 211 AD. His intact statue had been part of a group of bronzes that experts believe was set up 2,000 years ago as a shrine to the imperial cult in Bubon. As part of that cult, the emperors were worshipped

It's not clear whether the torso lost its head when the site was targeted by looters in the 1960s, or whether the separation had occurred centuries, or millenniums earlier. The Danish museum said in

its statement that "archival and archaeological studies and technical analyses" of Severus's head had led to its conclusion that it had been looted. The head, it said, "probably belongs to a larger group of bronze sculptures of the Roman imperial family believed to have originated from the socalled Sebasteion - a shrine to the Roman imperial cult — in Boubon.



The bronze head (left) is being returned as expert

### Circumstantial evidence

For many years, the Glyptotek had said that its ancient head belonged to the torso in the Met and had exhibited them together in Copenhagen in 1979. But in recent years, museum officials expressed scepticism that the two were an exact match, saying in an evidence linking them was "circumstantial and weak". The Met did not embrace

the theory. In the 12 years it held it, the museum called the figure simply a 'Bronze statue of a nude male figure'. The Glyptotek said that while its new research had determined that the head probably originated in

not as confident in asserting that it belonged to the body seized from the Met. The Danish museum said it had purchased the head in 1970 for 365,500 Swiss francs (about \$85,000) from Robert

Bubon, their experts were

who would become famous - and later infamous — as one of the world's great dealers of antiquities, both looted and legitimate.

Hecht, an American dealer

Investigators from the Manhattan district attorney's Antiquities Trafficking Unit have seized and returned several other items that experts believe were taken from Bubon, including statues of the emperors Lucius Verus and Caracalla.

- The New York Times 

# ports World Play



Australia Take Confidence from Pink **Ball Record: Carey** MELBOURNE: Australia wil

draw confidence from their exceptional record in day-night Tests and expect to rebound from their Perth setback when they face India in the second match in Adelaide, wicketkeeper Alex Carey has said. Australia have won 11 of their 12 pink ball Tests and all seven they have played at Adelaide Oval, including a victory over India in the last home test series when they skittled Virat Kohli's team for 36. "We're excited. We should take a lot - and we do take a lot of confidence out of our record from pink ball cricket," Carey told reporters on Tuesday. "It doesn't mean we'll have the success but I think our methods, our style of play and the experience we have with this group, we'll bounce back from Perth. "I'm sure India will be confident from the last game as well, so it will be a great contest," added Carey. Reuters



Messi, Ronaldo Only Nominees from Non-European Clubs Hoofddorp (Netherlands):

Lionel Messi and Cristiano Ronaldo are still popular and respected by their fellow players even though they no longer play for European clubs. The 37-year-old Messi and 39-year-old Ronaldo were the only players not with clubs in Europe to be voted on a 26man shortlist for the world team of the year organized by global players' union FIFPRO on Monday. The other 24 nominees played in the past year with clubs in England, Germany, Spain and France though Kylian Mbappé was the only French connection after spending last season at Paris Saint-Germain. No player from any Italian club was selected, nor from any club in South America or Africa. Messi, in Major League Soccer with Inter Miami, and Ronaldo, in Saudi

Arabia with Al-Nassr, will find

out on Dec. 9 if they are in the



The Catalan's recent antics make him look like his arch nemesis. He must heed the warning signs before he falls to the same fate

**Richard Martin** 

efore Manchester City headed to Liverpool on Sunday, Pep Guardiola had said "the previous nine years are dead", acknowledging that his glorious record in the past would not protect him if his side's dismalrun of form continued. So why then, as his side were on their way to a fourth consecutive Premier League defeat, did he hold up six fingers to the Anfield crowd?

As Guardiola raised one finger for each Premier League title won to Liverpool fans chanting "You're getting sacked in the morning," he was not living by that old business adage about only being good as your last success. Instead, he was using his previous achievements as a comfort blanket in a time of great distress.

There is nothing wrong with being proud of his astonishing achievements. But by pointing to his former successes amid his worst run of form as a coach, Guardiola is beginning to resemble another serial winning manager who lost his way when no one expected it - Jose Mourinho.

#### TODAY'S EMPIRES. **TOMORROW'S ASHES**

A fair few City fans were not alive the last time their team lost four Premier League games, in August 2008, just after the club had been taken over by the Abu Dhabi royal family. But they might well remember watching another coaching empire crumble and see similarpatternsof behaviourbetween Mourinho and their own boss.

The Portuguese won a third Premier League title with Chelsea in 2015, his eighth league crown, and then presided over one of the worst title defences in the league's history. Mourinho became more and more agitated with each defeat, and after losing

A fair few City fans were not alive the last time their team lost four Premier League games. But they might well remember watching another coaching empire crumble and see similar patterns of behaviour between ourinho and Guardiola

four out of the opening eight league games, he fired out a warning to the Chelsea hierarchy. "This is a crucial moment in the history of this club because. if they sack me, they sack the best manager this club has had," he said. But two months later; he was

**CALLING OUT HIS PLAYERS** 

Mourinho would boast about his achievements during good times and bad, whereas Guardiola preferred to praise his players. But now that he has fallen upon bad times, the Catalan is displaying the same traits. He's doing it with a smile, for now, and he has not yet resorted to the dark arts the Portuguese has dabbled in -poking rival coaches in the eye or shouting at referees in car parks. The previous week, Guardiola

went on what could be best described as a rant during his press conference before facing Tottenham, telling journalists on more than one occasion: "I'm sorry guys, I won six Premier League titles." He has also criticised his players, something he would very

rarely do previously. Unlike Mourinho, who loved to have a scapegoat, Guardiola has not yet focused on individuals. instead citing collective problems. After the 4-1 thrashing by Sporting CP, he said players were 'not emotionally stable". After the 4-0 hammering by Tottenham, he said the team were "fragile". How long before he turns on individuals again?

Two seasons ago, Guardiola called Kalvin Phillips "overweight" and questioned Kyle Walker's tactical intelligence. Phillips never recovered from that public slight, but as City won the treble it did not get much attention. Guardiola's remarks about Walker ended up leading to a remarkable resurgence in the form of the defender, who he begged to stay and who was then made captain. Walker now, however, looks to be on an irreversible decline; could the same thing be happening to

### WATCHOUT! Tonight

PREMIER LEAGUE Man City v Nottingham 1am; Newcastle v Liverpool 1am: Southampton v Chelsea 1am Arsenal v Man United 1:45am (Star Sports) LALIGA Athletic Club v Real Madrid 1:30am (GXR) ISL Hyderabad v FC Goa 7:30pm (Sports18)

#### Beatles are set to go on sale at UK auction house Dawsons on December 12. While creative differences, the strain of stardom and John Lennon's girlfriend

Pete Best left the group.

Hidden details

The documents, which were discovered in a cupboard where they

1970s, include copies of The Beatles advisor's minutes of meetings, legal writs and a copy of the band's 1967 'Original Deed of Partnership' They show that after

had been stored since the

New docs reveal legal woes behind Beatles split

manager Brian Epstein died in 1967, the band realised that their money was unaccounted for and that they were being pursued by tax authorities. They also document Paul McCartney's 1970 High Court battle against the band where he opposed Klein's hiring. "I could sense panic in

the room as more and more complexities came to light. One of the lawyers even suggested during one meeting when they had gone round and round and round in circles: 'Would it be easier if The Beatles just retired'?" shared Denise Kelly, head of Dawsons Entertainment and Popular Culture department.

A 1971 letter written by Lennon to musician Eric Clapton, inviting him to join a "nucleus group" with super-producer Phil Spector, is also set to be auctioned.

- AFP

### Indigo Moves Delhi High Court Against Alleged '6E' Trademark Infringement

moved the Delhi High Court alleging trademark infringement of its Air Transport Association code '6E' by Mahindra Electric Automobiles. The airline accused the

MATERIAL HANDLING

*Utkai Engineers* 

AN ISO 9001 14001 45001 CERTIFIED COMPANY

automaker of using the recused himself from the lar to its trademark '6E

Mahindra BE 6E, which has generated buzz for its unique design and tech loaded features, is expected to hit the roads in February next year. While Justice Amit Bansal

mark '6E' in its upcoming hearing the case, senior coelectric sports utility vehicle unsel Sandeep Sethi infor-New Delhi: InterGlobe Avia- (SUV) Mahindra BE 6e, med the court that Mahindtion, which runs the largest which it claimed to be simi-rahadreached out to the airline on Monday and an ef fort was being made to discuss the matter.

The case is likely to come up for hearing on December 9 The Registrar of Trade marks had on November 25

accepted Mahindra Electric's request to register its mark 'BE 6e' in class 12 (vehicles). If registered, Mahindra will be allowed to use 6E for a wide range of motor vehicles and related components, including land vehicles, off-road and utility vehicles, electric and internal combustion engine-powered vehicles, buses, trucks, tractors, and parts. However, the mark cannot be used for twowheelers and their compo-

nents. In response to the Indigo's petition, Mahindra & Mahindra (M&M) issued a clarification to stock exchanges stating that their mark "BE 6e" differs fundamentally from IndiGo's standalone "6E" trademark. The compa ny emphasized that their branding poses no risk of confusion since it represents an electric vehicle rather

### FROM OVERALL ALLOCATION OF ₹5.05 LAKH CR...

### Delayed Spending by States may Help Govt Save ₹30k cr this FY

Anuradha Shukla

New Delhi: Delayed spending by states and tighter monitoring of usage of funds under centrally sponsored schemes (CSS) could save the Centre about ₹30,000 crore in the overall allocation of ₹5.05 lakh crore for such programmes in the current fiscal year, according to an official.

The Centre is expected to use the savings under CSS to increase spending under other heads. "We expect the CSS expenditure

to be lower than the BE (budget estimates) by ₹28,000 crore to ₹30,000 crore in the current fiscal year," a senior official told ET. Officials said about ₹17,000 crore

may be saved on account of slow progress on spending in some of the flagship schemes due to the Lok Sabha and state elections this year. The Centre is likely to save another ₹13,000 crore by plugging loopholes in various schemes

The Centre had allocated ₹5.05 lakh crore for CSS in the budget for 2024-25, 9.8% higher than the target in the revised estimates in key flagship centrally sponsored schemes such as Ay-

ushman Bharat - Pradhan Mantri Jan Arogya Yojana (PMJAY) and the Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme (MGNREGS). This is almost half of the total capital expenditure for the current fiscal year. Currently. CSSs accounts for 10.4% of the Centre's expenditure budget of ₹48.2 lakh crore for the year.

The official said changes to allocation would be firmed up closer to the budget. "The Centre is nudging states to expedite spending but allocations may still remain unspent," the official said.

The government is already in the process of further rationalising the CSS, including share of funding between the Centre and the states. In March 2015, Prime Minister Narendra Modi had constituted a sub-group of chief ministers on rationalisation of CSS. The Centre has almost halved the number of centrally sponsored schemes to 75 from 130 in 2015. Officials said that some of the ministries are already doing their internal evaluation and may include the recommendation in their demand for funds for the budget for FY25.

### S Korea Prez Yoon Declares Martial Law

Seoul: South Korean President Yoon Suk Yeol on Tuesday declared martial law in an unannounced late night address broadcast live on YTN television, claiming he would eradicate "shameless

pro-North Korean anti-state forces"

He did not cite any specific threat from the nuclear-armed North, however, instead focusing on his domestic political opponents.—Reuters

### **Essen Speciality Films Limited**

(Formerly known as Essen Speciality Films Private Limited)

d. Office: Survey No. 192, Plot No. A. Indust Behind Orchev Pharma, Veraval (Shapar), Rajkot, Gujarat - 360024, India Contact: +91 98253 12701 | E-mail: compliances@essenspeciality.com Website: www.essenspeciality.com | CIN: L24224GJ2002PLC041119

SPECIALITY FILMS LTD

### NOTICE OF RECORD DATE FOR ISSUE OF BONUS EQUITY SHARES

NOTICE is hereby given that the Company has fixed Friday, December 13, 2024 as the record date for the purpose of determining the eligibility of shareholders for issuance of Bonus Shares in the ratio of 1:5 (i.e. 1 (one) new fully paid-up equity share of Rs. 10 each for every 5 (five) existing fully paid-up equity share of Rs. 10 each) ("Bonus Shares").

The Bonus Shares shall be allotted to the members of the Company whose names appear in the Register of Members maintained by the Company/ Beneficial Owners' Position as received from National Securities Depository Limited (NSDL) and Central Depository Services (India) Limited, as on the Record Date.

The Bonus Shares once allotted shall be subject to the terms of Memorandum & Articles of Association of the Company and shall rank pari-passu in all respects and carry the same rights as the existing fully paid equity shares of the Company.

> For, Essen Speciality Films Limited (Formerly known as Essen Speciality Films Private Limited)

Date :- December 03, 2024 Place :- Veraval (Shapar)

Pallav K. Doshi Chairman & Wholetime Director | DIN: 02542047

# PRE ENGINEERED www.loyapeb.com STEEL BUILDINGS

Industrial Sheds Showrooms Warehouses **Exhibition Halls** Aircraft Hangars



Shendra Jahagir, Near MIDC Shendra Aurangabad, Maharashtra, India - 431154 Plant II E-1/11, MIDC Deori, Gondia



than an airli-

ne service.

Bhadra Branch: Mission Road, Opp. Italian Bakery Bhadra, Ahmedabad, Gujarat 380001 Phone 079-25507912. Email: bhadra@indianbank.co.ir

Whereas, The undersigned being the authorized officer of the Indian Bank under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interes Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 8 & 9 of the Security Interest (Enforcement) rules, 2002 issued a demand notice dated 18.09.2024 calling upon the borrower / Guarantor / Mortgagor Mrs. Disha Shaileshbhai Gajjar and M Shalleshbhai Manubhai Gajjar having account with our Bhadra Branch to repay the amount mentioned in the notice being Rs. 11,24,043/- (Rupees Eleven Lakhs Twenty Four Thousand forty three only) together with further interest thereon at the contractual rate plus costs, charges and expenses till date of repayment within 60 days from the date of said notice

erein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with Rule 8 & 9 of the said rule on this 2nd day of December, 2024. The borrower/ Guarantor/ Mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Indian Bank for an amount Rs. 11,24,043/- (Rupees Eleven Lakhs Twenty Four Thousand forty three only) as on 17.09.2024 with further interest, costs, other

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described

charges and expenses till date of payment. **Description of Immovable Property** 

All that piece and parcel of free hold immovable property being Flat No. C-105 on First Floor Admeasuring 86.21 sq.mtrs with undivided share of land admeasuring 33.05 sq mtrs in Shree Hari (Vinzol) Co. Op. Hsg. Soc. Ltd. Part-1, known as Panchratna Homes, lying and situated on land bearing sub plot No. 1, F P No. 21/1, TPS No. 73 of survey No. 46/1 of Vinzol village Taluka - Vatva, sub registration district Ahmedabad-11 (Aslali), District - Ahmedabad, N Panchratna Residency, S P Ring Road, Vinzol, Ahmedabad-382445. Boundary: North TPS Road, South: FP No. 35/1, East: Sardar Patel Ring Road, West: FP No. 20 **Authorised Office** Date: 02.12.2024 For, Indian Bank

# AIC STPINEXT INITIATIVES

(A Section 8 Company incorporated by STPI) STPI Elite Building, IDCO Plot No.2/A, Industrial Area, Gothapatna, PO: Malipada, Dist: Khorda Bhubaneswar-751003, Tel. No. 0674-2623000, URL: www.stpinext.in, www.stpi.in



Employment Notice: 3/2024/STPINEXT/EMTEK, Date: 04.12.2024

Centre of Entrepreneurship in Emerging Technologies (CoE-EmTeK) under Software Technology Parks of India (STPI), Bhubaneswar hereby invites online applications from the eligible candidates for filling up the following vacancies:

- Manager (Administration & Accounts) at Bhubaneswar 01
- 2. Platform Support Technology Professional at Bhubaneswar 01
- Technical Officer (at Satellite Centre), BPUT Rourkela 01

The above said vacancies are proposed to be filled up purely on contract basis for a period of 3 years or co-terminus with CoE, whichever is earlier, which may be renewed based on performance subject to extension of project tenure. For detailed information and to submit online application for the aforementioned vacancies,

interested applicants may visit the website of the company www.stpinext.in or https://bhubaneswar.stpi.in or www.emtek.stpi.in or www.stpi.in.

Last date for submission of application is 21days from the date of publication of this employment notice

### ph +91 98233 85115 ph +91 98506 87460 sales@loyapeb.com



બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના

ગાંધીનગર : બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ ભાઈ-બહેનો અને બાળકો પર સતત અમાનુષી અત્યાચારોની સાથે તેમની માલ-મિલકતને મોટું

નુકસાન કરવામાં આવી રહ્યું છે. આ અત્થાચારોનો સખત વિરોધ

ભારતમાં ઠેર-ઠેર થઈ રહ્યો છે ત્યારે ગાંધીનગર સનાતન જાગરણ

સત્યાગ્રહ છાવણી સેક્ટર-૦૬ ખાતે 'જાહેર ધરણા પ્રદર્શન કાર્ચક્રમ'

બેનરો સાથે મહારેલી ચોજી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે.

આ કાર્ચક્રમમાં ગાંધીનગર શહેર-જિલ્લામાંથી અંદાજે હ,૦૦૦ થી વધ

E-Tender Notice No.: SUBZONE-05/02/2024-25

Empanelment of Contract for the works of RCC Road, Paver Block, Water, Drainage under 70:20:10 Scheme

Total No. of Tenders: 4

upto 18:00 hrs

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

(મહાનગર સેવા સદન)

શ્રીમતી શા.ચી.લા.મ્યુનિ.જન.હોસ્પિટલ

સરસપુર, અમદાવાદ-૩૮૦૦૧૮

ટેન્ડર નોટીસ

શ્રીમતી શા.ચી.લા.મ્યુનિ.જન. હોસ્પિટલમાં

પાર્કિંગ સ્ટેન્ડ ચલાવવા અંગેનું ઈ-ટેન્ડર

શ્રીમતી શા.ચી.લા.મ્યુનિ.જન.હોસ્પિટલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

દ્વારા ઉપરોક્ત બાબતે સીલબંધ કવરોમાં ટેન્ડરો મંગાવવામાં આવે છે. રસ ધરાવતી

પાર્ટીઓ / એજન્સીઓએ અ.મ્યુ.કો.ની વેબસાઇટ: https://

www.ahmedabadcity.gov.in ਦੀਰੀ https://tender.nprocure.com

परथी टेन्डर डाઉनલोड કरवानां रहेशे. ओन-दार्धन टेन्डर स्वीडारवानी छेट्सी

તારીખ અને સમય : તા.3૧/૧૨/૨૦૨૪ ના રોજ સાંજે ૬.૦૦ વાગ્યા સુધી,

डीजीडल टेन्डर स्विडारवानी तारीण अने समय : ता.०४/१२/२०२४ना रोज

૧૧.૦૦ ક્લાક થી તા.૦૧/૦૧/૨૦૨૫ ના રોજ બપોરે ૨.૦૦ વાગ્યા સુધીની રહેશે

સંપૂર્ણ વિગતો સાથેનું ટેન્ડર રૂબરૂ / સ્પીડ પોસ્ટ / રજી. પોસ્ટ / કુરીયર મારફતે

ટેન્ડર ઓફિસરશ્રીને ટેન્ડર ઓફિસરશ્રીની કચેરી, પહેલો માળ, રેકર્ડ ઓફિસ,

PUBLIC NOTICE

IN THE COURT OF GUJARAT AT AHMEDABAD

R/FIRST APPEAL NO. 1024 OF 2024

WITH CIVIL APPLICATION NO. 1 OF 2024

BHIKHABHAI HIRABHAI PATEL & ORS.

2. RAVJIBHAI POPATBHAI VASANI

BAPUNAGAR, AHMEDABAD. 3. KIRANKUMAR RAVJIBHAI VASANI

BAPUNAGAR, AHMEDABAD.

BAPUNAGAR, AHMEDABAD.

BAPUNAGAR, AHMEDABAD.

BAPUNAGAR, AHMEDABAD,

BAPUNAGAR, AHMEDABAD.

BAPUNAGAR, AHMEDABAD.

BAPUNAGAR, AHMEDABAD.

7. BABUBHAI POPATBHAI VASANI

8. MANJULABEN BABUBHAI VASANI

MADHUBHAI POPATBHAI VASANI

10. RAJESHBHAI SAVJIBHAI VASANI

4. HARESHKLIMAR RAVIIRHAI VASANI

6. SHOBHABEN KIRANKUMAR VASAN

DILIPKUMAR SHAMUBHAI SEKHAVADA & ORS.

ADD, AT: 41, KRISHNANAGAR SOCIETY, INDIA COLONY ROAD.

ADD. AT: 41, KRISHNANAGAR SOCIETY, INDIA COLONY ROAD,

ADD. AT: 41, KRISHNANAGAR SOCIETY, INDIA COLONY ROAD,

ADD. AT: 41, KRISHNANAGAR SOCIETY, INDIA COLONY ROAD,

ADD, AT: 41, KRISHNANAGAR SOCIETY, INDIA COLONY ROAD.

ADD. AT: 41, KRISHNANAGAR SOCIETY, INDIA COLONY ROAD,

ADD. AT: 41. KRISHNANAGAR SOCIETY, INDIA COLONY ROAD.

ADD. AT: 41, KRISHNANAGAR SOCIETY, INDIA COLONY ROAD,

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પીરેશન , દાણાપીઠ ખાતે સબમીટ કરવાનાં રહેશે .

**AHMEDABAD** 

**MUNICIPAL CORPORATION** 

South Zone-Sub Zonal Office-05

(Khokhra - Indrapuri Ward)

From 04/12/2024 to Dt. 24/12/2024

Dt. 26/12/2024 upto 16:00 hrs.

To be intimated after technical

https://tender.nprocure.com

Dy. Municipal Commissioner

સહી/- ડે. મ્યુનિસિપલ કમિશનર

Fixed on: 19/12/2024

District : AHMEDABAD

for the Appellant

. Appellant(s

. Respondent(s)

(श्रीभती शा.यी.सा.म्युनि.छन.होस्पिटस)

MR. DHRUVIK K. PATEL Learned Advocate

Dt. 27/12/2024 12:00 hrs.

મંચના ઉપક્રમે આજે બુધાવરે તા. ૪ ડિસેમ્બરને બપોરે 3 કલાકે

ચોજવામાં આવ્યો છે. આ કાર્ચક્રમ બાદ વિરોધ દર્શાવતા વિવિધ

હિન્દુ ભાઇ-બહેનો સહભાગી થશે.

nn

Date of Online Tender

Last Date of Physical

Tender Submission Technical Bid

Price Bid Opening

**Details & Tenders** 

available on

Submission

Opening Date

વિરુદ્ધમાં આજે ગાંધીનગરમાં ધરણાં-રેલી

# ગાંધીનગરમાં સ્માર્ટ સિટીના ગૌરવને તંત્રની અણઘડ કામગીરીનું ગ્રહણ

# બે મહિના પહેલાં રૂ.17 કરોડના ખર્ચે બી.ઝેડ.માં રોકાણ કરાવી રોકાણકારોને ડૂબાડ્યા

**નવગુજરાત સમય** > ગાંધીનગર

🚃 પાટનગર ગાંધીનગરને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની નેમ સાથે કરોડોના ખર્ચે મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો અમલ કરાયો છે. ગાંધીનગરના નિર્માણમાં ખાતે 3.17 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાના 'ગૌરવપથ'નું નિર્માણ કરાયું છે. જેનું ઓક્ટોબર મહિનામાં ગૌરવપથનું લોકાર્પણ કરાયું હતું. બે મહિનામાં જ

અનેરૂ આકર્ષણ ઉમેરવાના હેતથી કડાસણ તરીકે વિકસાવાયો છે. ગૌરવ પથ પર જગ્યામાં દૃકાનના સંચાલકો-સ્ટાફના મીટરની પાર્કિંગ માટેની જગ્યા અપાઈ રસ્તા પર વાહનો મુકી દેતા હોય છે. સુત્રો

જણાતાં તોડકોડનો નિર્ણય લેવો પડ્યો છે. શરૂ કર્યો ત્યારે તંત્રને ડીઝાઈનમાં રહેલી અને દકાનોની વચ્ચે પાર્કિંગ માટે જગ્યા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ખામીનો અનુભવ થઈ રહ્યો છે. ફટપાથ કડાસણ ખાતે મુખ્ય માર્ગને સરદાર ચોક માટે 5 મીટર પહોળી જગ્યા રાખવા જતાં સધી જોડતા 1.3 કિમી લંબાઈ તથા 30 પાર્કિંગ માટે માત્ર 2.5 મીટર જગ્યા જ મીટર પહોળાઈના માર્ગને 'ગૌરવપથ' મળી શકી છે. દુકાનની સામે પાર્કિંગની નાગરિકોને ચાલવા માટે રોડની બંને વાહન મૂકાય તે સ્વાભાવિક છે, પરંતુ બાજુ 5 મીટરની ફૂટપાથ તેમજ રસ્તા તેના કારણે અન્ય વાહનોને પાર્કિંગની પર થતા પાર્કિંગને અટકાવવા માટે 2.5 જગ્યા મળતી નથી. પરિણામે અનેક લોકો

ઊભી કરવાની વિચારણા ચાલી રહી છે. જેથી દુકાનદારો પોતાના વાહનો અંદર મૂકી શકે અને નાગરિકોને પાર્કિંગની પરતી જગ્યા મળી રહે. ગૌરવ પથની સુંદરતાને નુકસાન પહોંચાડ્યા વગર ટુંક સમયમાં તોડફોડ શરૂ કરવામાં આવશે. આ તોડફોડનો બોજ મ્યુનિ. કચેરી પર ના પડે તે માટે સંબંધિત એજન્સી પાસે જ આ ડીઝાઈનમાં ફેરફાર કરાવવામાં આવશે.

# સાબરકાંઠાના કેટલાક શિક્ષકોએ એજન્ટ બની

» હિંમતનગર પ્રાંતિજ અને વિજયનગરના શિક્ષકો એજન્ટ બન્યા હતા

**નવગુજરાત સમય** > હિંમતનગર

સાબરકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકોએ બી.ઝેડની લોભામણી સ્ક્રીમમાં રોકાણકારોના નાણાં રોકાણ કરાવી દીધા બાદ હાલ તો રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે શિક્ષક તરીકે નોકરી કરતાં કેટલાક સરકારી કર્મીઓએ બીઝેડના એજન્ટ બની રોકાશકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવીને તગડું કમિશન મેળવતા હતા.

હિંમતનગર, પ્રાંતિજ અને વિજયનગર મિત્રો, શિક્ષકો, સગા-સંબંધીઓના આવ્યા છે. ભોળા રોકાણકારોના લાખો તાલુકાના કેટલાક શિક્ષકોએ શૈક્ષણિક નાણાં બી.ઝેડ ગ્રુપમાં રોકાણ કરાવી રૂપિયાનું ભુપેન્દ્રસિંહ ઝાલાની પોન્ઝી કાર્યની સાથે સાથે રોકાણકારો સાથે મિટીંગો કરતા હોવાના વીડિયો વાઇરલ થતાં જિલ્લા શિક્ષણાધીકારીએ પણ તપાસ શરૂ કરી હોવાનું માલુમ પડ્યુ છે. ભુપેન્દ્રસિંહ ઝાલાએ લોભામણી લાલચો આપીને અનેક લોકોના નાણાંનં રોકાશ કરાવ્યું , મોટાભાગે શિક્ષકોએ

કમિશન મેળવ્યું હતું. જોકે સોશિયલ મીડિયામાં આ શિક્ષકોના વીડિયો વાયરલ થયા છે. ત્યારે પ્રાંતિજ તાલુકાનો એક, વિજયનગર તાલુકાના બે, હિંમતનગર તાલુકાના બે તથા પ્રાંતિજ તાલુકાના એક શિક્ષક સહિત તમામ તાલુકાઓમાં આવેલા જથ કેન્દ્રોમાં કરજ બજાવતા કેટલાક લાલચુ શિક્ષકોના નામ બહાર

સ્કીમમાં રોકાશ કરાવી દીધું છે. એટલુ જ નહીં પણ કેટલાક શિક્ષક તરીકે ફરજ બજાવતા એજન્ટોએ દરરોજ અંદાજે રૂ. ૪ કરોડથી વધુનું રોકાશ કરાવીને કમિશન ખાતા હતા. લોકચર્ચા મુજબ આ શિક્ષકો પોતાને મળતા કમિશનમાંથી તેમના ઉચ્ચ અધિકારીઓને બી ઝેડના નામે મોંઘી ગીફ્ટ પણ અપાવતા હતા.

बैक ऑफ़ इंडिया BOI

કમિશન મેળવવાની લાલચમાં પોતાના

**ઇંક ઓક ઇન્ડિયા, ઇસનપુર શાખા :** સરનામું – દુકાન ને. ૪/૫/૬, ગાઉન્ડ ફ્લોર, કંસાસ બિલ્ડિંગ, ઇસનપુર ઘોડાસર ચાર રસ્વા, અમદાવાદ – ૩૮૨૪૪૩, ટેલી.નં. ૦૭૯−૨૫૮૩૦૨૨૩ ઇમેલ : isanpur.ahmedabad@bankofindia.co.in

ತಿಗಿಗಿರ

નોચે દર્શાવેલ ખાતાઓ એન.પી.એ. થયેલ છે. આ અંગે ડિમાન્ડ નોર્ટીસ બેંક તરફથી તમો ઉદારકર્તાને સિક્યુરીટાઈપ્રેશન અને રીકન્સ્ટ્રક્શન ઓર્ ફાઈનાન્સીયલ એસેટ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ (કાયદા) ૨૦૦૨ હેઠળ નીચે જણાવેલ ઉદારકર્તા ને રજસ્ટર્ડ પોસ્ટ એ.ડી હારા મોકલાવેલ હતી પરંતુ તે નોટિસ બજવણી થયા વિના **"Left"** શેરા સાથે પરત આવેલ છે.

હિદ્યારકર્તા અને જામીનદારનું નામ	डीभान्ड नोटीसनी तारीफ	ફેસીલીટી નો પ્રકાર	સીક્ચોર્ડ મિલકતોની વિગત
શ્રી સુરેશ રામનારાચણ કુસવાહ, ઇ-4/3, મારૂતિ રેસીડેબ્લી, ચંદ્રવોક રેસી. પાસે, મદ્રાસી મંદિર પાછળ, વટવા, અમદાવાદ, ગુજરાત – ૩૮૨૪૪૦ અન્યઃ રો–હાઉસ નં. પઠ, પિકનીક પાર્ક કો.ઓપ. હાઉસીંગ રેસિડેબ્લી, વટવા રેલ્વે કોસિંગ, અમદાવાદ શ્રી ઇન્દ્રમીહન પરીક એ-4-૧૬, મારૂતિ રેસીડેબ્લી, મદ્રાસી મંદિર પાછળ, વટવા, અમદાવાદ –	98.99.2028	સ્ટાર હોમ લોન	રથાવર મિલકત આવેલ રો–હાઉસ નં. ૫૯, આવેલ પ્લોટ એરિયા ક્ષેત્રફળ ૪૦ સ્કવેર મીટર્સ સાથે તેના પરનું બાંધકામ ક્ષેત્રફળ ૩૦ સ્કવેર મીટર્સ સાથે વણવેચાયેલ ભાગ કોમન પ્લોટની અવિભાજીત જમીનમાં (મ્યુનિસિપલ ટેનામેન્ટ નં. ૦૩૧૮–૩૧– ૦૩૯૧–૦૦૦૧–જે) પિકનીક પાર્ક કો–ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લિમિટેડમાં જે બિનખેતીલાયક જમીન પર આવેલ સર્વે નં. ૧૦૫૩ + ૧૦૫૪ + ૧૦૬૨, મોજે વટવા ખાતે આવેલ અને સ્થિત, તાલુકા અમદાવાદ સિટ્ટા સ્ટ્રાસ્ટ્રશન ડિસ્ટ્રીક્ટ અમદાવાદ અને સબ ડિસ્ટ્રીક્ટ અમદાવાદ ન ૧૧ (અસલાલી) ખાતે આવેલ સમગ્ર મિલકત જેની ચર્તુ:સીમા: પૂર્વે: રો હાઉસ નં. ૫૮, પશ્ચિમે: રો હાઉસ નં. ૬૮, ઉત્તરે: રો હાઉસ નં. ૬૯, દિલિણે: રો હાઉસ નં. ૫૪. CERSAI Registration ID: 2000 10747050
	એનપીએની તારીખ	મંજૂરીની મર્ચાદા	
	8P05, 30.0E	हा. १६,४०,०००/-	
		બાકી લેણા	
		₹I. 3४,03,0२٩.੫४/-	

ઉદ્યારકર્તા ને આથી જણાવવામાં આવે છે કે બેંકના અધિકત અધિકારીશ્રી સરકેરી કાયદામાં આવેલ જેગવાઈ અનસાર ઉદ્યારકર્તા ઉપર જણાવે 25મ આ જાહેર ખબરની તારીખ થી ૬૦ દિવસની અંદર નહીં ભરી જાય તો ઉપર પ્રમાણેની ગિરવે મુકેલ મિલકત / મુકરર સંપતિ નો કબજો લઈ પછી હરાજી કરશે. તથા સરફેસી કાયદાની કલમ ૧૩(૧૩) હેઠળ ઉધારકર્તા ને મજુકર મિલક્તો ફેરબદલ કે ટ્રાન્સફર કરવાની મનાઇ ફરમાવે છે. આ જાહેર નોટીસ

સરફેરી કાયદા ૨૦૦૨, ની કલમ ૧૩(૨) અંતર્ગત આપેલ છે. **એમ ગણવું. સદરહુ નોટીસ મિલક્ત ઉપર તા. ૩૦.૧૧.૨૦૨૪ ના રોજ ચોટાકેલ છે.** ઉધારકર્તા એ અસલ નોટીસ જે કલમ ૧૩(૨) હેઠળ આપેલ હતી તે બેંકના કામકાજના દિવસો દરમ્યાન જરૂરી પાવતી આપી મેળવી લેવી. "સદરહુ ાયદાની કલમ ૧૩ની પેટા કલમ ૮ ની જોગવાઈ પ્રત્યે ઉદ્યારકર્તાનું મુકરર મિલકત છોડાવવા માટે મળવા પાત્ર સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે." સહી/- અધિકૃત અધિકારી, બેંક ઓફ ઈન્ડિય તારીખ : ૦૩.૧૨.૨૦૨૪,

बैक ऑफ़ इंडिया BOI

એંક એક ઇન્ડિયા, ઇસનપુર શાખા : સરનાયું – દુકાન ને. ४/५/६, ગ્રાઉન્ડ ફ્લોર, કંસાસ બિલ્ડિંગ, ઇસનપુર ઘોડાસર ચાર રસ્તા, અમદાવાદ – ૩૮૨૪૪૩, ટેલી.નં. ૦૭૯–૨૫૮૩૦૨૨૩ ઇમેલ : isanpurahmedabad@bankofindia.co.in

SiHIOS

નીચે દર્શાવેલ ખાતાઓ એન.પી.એ. થયેલ છે. આ અંગે ડિમાન્ડ નોટીસ બેંક તસ્ફથી તમો ઉદ્યાસકર્તાને સિક્યુરીટાઈપ્રેશન અને રીકન્સ્ટ્રક્શન ઓડ્ડ ફાઈનાન્સીયલ એસેટ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ (કાયદા) ૨૦૦૨ હેઠળ નીચે જણાવેલ ઉદ્યાસકર્તા ને રજસ્ટર્ડ પોસ્ટ એ.ડી હારા મોકલાવેલ હતી પરંતુ તે નોટિસ બજવણી થયા વિના "**Left"** શેરા સાથે પરત આવેલ છે.

ડીમાન્ડ ફેસીલીટી નો

<b>नो</b> ढीसनी तारीफ	Neis	વિગત
98.99.2028	મિલકત સામે સ્ટાર લોન	મિલકત આવેલ ક્લેટ નં. સી-વ/૧૧, વ્લોક સી-૧ ક્ષેત્રફળ ૫૮.૫૨ સ્કવેર મીટર્સ સુપર બિલ્ટ આપ એરિયા સાથે કોમન એરિયા તપરાશના હક્ક સાથે, પેસેન્, અમેનીનીસ અને સવલતો સાથે અબિભાજીત લાગ્લેચાચેલ માલિકી હક્કો ટાઇટલ અને ઇન્ટરેસ્ટ સાથે જમીનમાં જેનું ક્ષેત્રફળ સ્ર.૪૦ સ્કે.મીટર્સ, મારૂતિ રેસીડેન્સી તરીકે જાણીતી સ્કીમમાં, મોજે ગામ વટવાની જમીન પર થયેલ ખાંધકામ, સીમ સર્વ નં. ૧૦૦૮ ક્ષેત્રફળ ૦૫૬ - દૃદ્દ હે.આરે, ટાઉન પ્લાંબીંગ સ્કીમ નં. ૮૬, ફાઇનલ પ્લોટ નં. ૩૮ ક્ષેત્રફળ ૩૪૦૦ સ્કવેર મીટર, મોજે વટવા તાલુકા દસ્કોઇ અમદાવાદ – ૧૧ (અસલાલી) ખાતે આવેલ અને સ્થિત સમગ્ર મિલકત જેની સર્વુ:સીમાઃ પૂર્વે: વ્લોક ડીન્વ, પશ્ચિમેઃ જોડેનો ફલેટ નં. સી-૧/૧૦, દિલિણે: જોડેનો ફલેટ નં. સી-૧/૧૦, દિલિણે: જોડેનો કોમન પ્લોટ. CERSAI Registration ID:
છેનપીએની તારીખ	મંજૂરીની મર્ચાદા	
30.06.2098		
	१४.११.२०२४ मेनपीयोनी तारीण 30.06.२०१६	૧૪.૧૧.૨૦૨૪ મિલકત સામે સ્ટાર લોન મેનપીએની તારીખ મંજૂરીની મર્ચાદા ૩૦.૦૯.૨૦૧૬ સા. ૧૩,૭૫,૦૦૦/– બાકી લેણા

ઉધારકર્તા ને આથી જણાવવામાં આવે છે કે બેંકના અધિકૃત અધિકારીશ્રી સરફેરી કાયદામાં આવેલ જોગવાઈ અનુસાર ઉધારકર્તા ઉપર જણાવેલ ટકમ આ જાહેર ખબરની તારીખ થી ૬૦ દિવસની અંદર નહીં ભરો જાય તો ઉપર પ્રમાણેની ગિરવે મુકેલ મિલકત / મુકરર સંપતિ નો કબજો લઈ પછી હરાજી કરશે. તથા સરફેસી કાયદાની કલમ ૧૩(૧૩) હેઠળ ઉધારકર્તા ને મજુકર મિલકતો ફેરબદલ કે ટ્રોન્સફર કરવાની મનાઈ ફરમાવે છે. આ જાહેર નોટીસ સરફેસી કાયદા ૨૦૦૨, ની કલમ ૧૩(૨) અંતર્ગત આપેલ છે. **એમ ગણવુ. સદરહુ નોટીસ મિલકત ઉપર તા. ૩૦.૧૧.૨૦૨૪ ના રોજ ચોટાડેલ છે.** ઉધારકર્તા એ અસલ નોટીસ જે કલમ ૧૩(૨) હેઠળ આપેલ હતી તે બેંકના કામકાજના દિવસો દરમ્યાન જરૂરી પાવતી આપી મેળવી લેવી. "સદરહુ

સહી/- અધિકૃત અધિકારી, બેંક ઓફ ઇન્ડિય તારીખ : ૦૩.૧૨.૨૦૨૪,

ાયદાની કલમ ૧૩ની પેટા કલમ ૮ ની જોગવાઈ પ્રત્યે ઉદ્યારકર્તાનું મુકરર મિલક્ત છોડાવવા માટે મળવા પાત્ર સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે."



Par Drugs And Chemicals Limited

Registered office: 815, Nilamber Triumph, GotriVasna Road, Vadodara-390007 Gujarat India

Phone no.: 0265-2991021, 0278-2447013

Website: www.pardrugs.com Email: investors@pardrugs.com

### **NOTICE TO THE SHAREHOLDERS**

Notice is hereby given that the Extra-ordinary General Meeting ("EGM") of the members of Par Drugs And Chemicals Limited ("Company") will be held on Tuesday, 31st Day of December, 2024 at 3:00 P.M. (IST) through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") pursuant to applicable provisions of the Companies Act, 2013 read with Circular no. 14/2020 dated April 8, 2020, General Circular no. 17/2020 dated April 13, 2020, General Circular no. 22/2020 dated June 15, 2020, General Circular no. 33/2020 dated September 28, 2020, General Circular no. 39/2020 dated December 31, 2020, General Circular no. 09/2023 dated September 25, 2023 and General Circular no. 09/2024 dated September 19, 2024 issued by Ministry of Corporate Affairs (collectively 'MCA Circulars') and SEBI Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020, SEBI Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021, SEBI Circular No. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 dated October 07, 2023 and SEBI Circular No. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2024/133 dated October 3, 2024 to transact the businesses, as set out in the notice of EGM which shall be circulated for convening EGM.

In compliance with the said Circulars and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015 as amended time to time, the Notice of EGM along with required documents will be sent only by way of electronic means to those members whose email addresses are registered with Company/Depositories/Share Transfer Agent. Further, members may note that the Notice of EGM and other communications as and when issued will be made available on the Company's website at www.pardrugs.com and website of the National Stock Exchange of India Limited at www.nseindia.com The instruction for joining EGM will be provided in the Notice of EGM. The members attaining the meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum under section 103 of Companies Act, 2013.

The Company is providing remote e-voting facility ("remote e-voting") and e-voting facility ("e-voting") during the EGM to all its members to cast their votes on all resolutions set out in the Notice of the EGM. Detailed procedure for remote e-voting and e-voting will be provided in the Notice of EGM. If your email ID is already registered with Company/Depositories/Share Transfer Agent, login details for e-voting are being sent on your registered email addresses. In the view of above we urge shareholders for registration/updation of their Email Ids as per instructions given below to ensure receipt of Notice of EGM, Login details for Remote

e-voting/e-voting or any other communication timely, faster and easier and more importantly avoid frauds in any case.

Accordingly, to update the details with Company, following procedure may be followed: **Procedure** 

PHYSICAL HOLDING:	E-mail Registration:
	Go to on the website www.linkintime.co.in;
	Choose Investor Services and go to the E mail / Bank Registration or at link at https://liiplweb.linkintime.co.in/EmailReg/Email_Register.html
	Select our Company Name & follow the registration process as guided there in;
	<ol> <li>Provide details such as Name, Folio Number, Certificate number, PAN, mobile number and e mail id and also upload the image of share certificate in PDF or JPEG format. (upto 1 MB);</li> </ol>
	<ol><li>OTP will be received by you which need to be entered in the link for verification</li></ol>
DEMAT HOLDING:	Permanent E-mail Id Registration:

respective Depository Participant (DP) by following the procedure prescribed by the respective DP.

Temporary Registration of E-mail Id:

This will only help us in getting with touch with you in case of reminders emails for unclaimed dividend if any further the data will be only use as referral data and will not be updated in the system.

1. Follow first three steps as given in the e-mail registration of physical

2. Provide details such as Name, DPID, Client ID/ PAN, mobile number and

It would be highly appreciated that shareholders to co-operate, support and do the needful at

For Par Drugs And Chemicals Limited, Mr. Sanket B. Trivedi

Company Secretary & Compliance Officer

મા બહુચરને માગશર સુદ બીજના રોજ પરંપરાગત રસ-રોટલીનો પ્રસાદ ધરાવાયો ...

મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં બિરાજમાન જગતજનની મા બહુરારે ૩૦૦ વર્ષ પૂર્વે પોતાના પરમભક્ત વલ્લભ ભટ્ટ અને દ્યોળા ભટ્ટની લાજ રાખી ચમત્કારરૂપે ભરશિચાળામાં માગશર સુદ બીજના રોજતેમની નાતને રસ-રોટલી જમણ આપ્યું હતું. માતાજીનું ઋુણ ચુકવવા ભક્તો દર વર્ષે માગશર સુદ બીજના દિવસે માતાજીને રસ-રોટલી સાથે અન્નકુટનો પ્રસાદ ધરાવી પરંપરા નિભાવવામાં આવી રહી છે. આજે માગશર સુદ બીજે મતાજીને રસ-રોટલીનો પ્રસાદ ધરાવી ભક્તોને ૪ હજાર લીટર કેરીનો રસ, ૬ હજાર રોટલી, ૧૦૦ કિગ્રા ડ્રાયફ્ટ તેમજ ૬૦૦ કિગ્રા મીઠાઈનો અન્નકુટ સ્વરૂપે ભોજન પીરસવામાં આવ્યું હતું.



## ગાંધીનગર તા. પં.ની પ્રાથમિક મતદારયાદી 12મીએ પ્રસિદ્ધ થશે

» ચૂંટણી માટે EVMની ચકાસણી, બૂથ અને મતદાન સહિતની પ્રક્રિયામાં તંત્ર વ્યસ્ત

**નવગુજરાત સમય** > ગાંધીનગર

અને ત્યાર બાદ ગ્રામ પંચાયતો સહિત રોજ કરવામાં આવશે.

આગામી તારીખ 20મી ડિસેમ્બરના છેલ્લા અગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે. સપ્તાહમાં જાહેર થાય તેવી શક્યતાઓ આટલા મતદાન મથકો માટે કુલ મળીને વર્તાઇ રહી છે. તેમાં ગાંધીનગર 266 બેલેટ યુનિટ અને 282 કંટ્રોલ યુનિટ જિલ્લાની એક માત્ર ગાંધીનગર તાલુકા તૈયાર કરવામાં આવશે.

તારીખ: 03 ડિસેમ્બર, ૨૦૨૪

સ્થળ: વેરાવળ (શાપર)

પંચાયતની ચૂંટણી પણ થવાની છે. તેના પગલે ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકોનું રોટેશન તા. ર ડિસેમ્બરના રોજ જાહેર કરી દેવામાં આવ્યું હતું. તે પછી હવે ચૂંટણી તંત્ર મતદાન સહિતની પ્રક્રિયા માટેની તૈયારીઓમાં વ્યસ્ત થઇ ગયુ તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ છે. ચૂંટણીમાં મતદાન માટે ઉપયોગમાં લેવાના ઇલેકટ્રોનિક વોટિંગ મશીન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની તૈયાર કરવા ગાંધીનગર ખાતે સેક્ટર ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. તેમાં 15માં આવેલી સરકારી ઇજનેરી કોલેજમાં ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી નિષ્ણાંત ઇજનેરો દ્વારા ઇવીએમની પણ યોજાવાની છે. તે માટે ચૂંટણી તંત્ર પ્રથમ ચકાસણીની પ્રક્રિયા પુરી કરી દ્વારા EVMની ચકાસણી, બુથ અને દેવામાં આવી હતી. ચકાસણી દરમિયાન મતદાન સહિતની પ્રક્રિયા કરવામાં તંત્ર આઇટીઆઇના અધિકારી, કર્મચારીઓને વ્યસ્ત તઇ ગયુ છે અને મતદારયાદીની પણ ઉપસ્થિત રાખવામાં આવ્યા હતાં. પ્રાથમિક પ્રસિધ્ધિ તા. 12મી ડિસેમ્બરના ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં 28 બેઠકોનાં વિસ્તારમાં 229 મતદાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મથકો નિયત કરવાની કાર્યવાહી

### ગાંધીનગરના સે-22માં બંધ મકાનમાં આગથી રહીશોમાં ગભરાટ : ફાયરબ્રિગેડે કાબૂ મેળવ્યો

ગાંધીનગર: ગાંધીનગરના સેક્ટર-22 ખાતે બંધ મકાનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. મકાનના રૂમમાં સંખ્યાબંધ ટાયર અને ગેરેજનો સામાન પડેલો હતો. આગના કારણે આસપાસના રહીશોમાં ભારે ગભરાટ ફેલાચો હતો, પરંતુ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબ્ર મેળવી રાહત અપાવી હતી. ફાચર્ટ બ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, બપોરે 2.40ના અરસામાં મિતરાજસિંહ રાઠોડનો કોલ આવ્યો હતો. સેક્ટર-22 ખાતે પ્લોટ નંબર-558માં આવેલા બંધ મકાનમાં આગ લાગી હોવાનું જણાવ્યું હતું. સેક્ટર-22 ખાતે આવેલા પુષ્પક એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઓવેલાં મકાનમાં લાગેલી આગ મુખ્ય દરવાજા અને રૂમ સુધી પહોંચી ત્યારે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી. લાશ્કરોએ ગેંશતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં અકસ્માત કે મોટું નુકસાન નિવારી શકાયુ હતું. ફાયરબ્રિગેડની ટીમે મકાનમાં પહોંચીને આગના કારણો જાણવા પ્રયાસ કર્યો હતો. એક રૂમમાં સંખ્યાબંધ ટાયર અને ગેરેજનો સામાન હતો. આગની જ્વાળાઓ ટાયર સુધી પહોંચી હોત તો ભચંકર હોનારત બની શકત.

### IndusInd Online/offline bids are invited for sale of the follow vehicles/machinery on 'as-is-where-is' basis.

Loan No: 933000043893, Name o Loan No: 93200U43899, Name of Borrower: MR.NISHNUJJI THAKOR, Co-borrower: MR.NISHNUJJI THAKOR, CO-borrower: MR.NIARESHKUMAR JJVATAJI N MAKWANA, Vehicle Model & YOM: TATA ACE HT PLUS, 2024, Regn No: GJ18BV7628, Parking Yard: JAY NAGDEV FARM MEHISAMA FARM, MEHSANA

FARM, MEHSANA
Loan No: GAG02374G, Name of
Borrower: MR.G SINDHI, Co-borrower:
MRS.S MUMTAJBIBI, Vehicle Model &
YOM: ATUL RIK PLUS 3P CNG, 2023,
Regn No: J18BU5176, Parking Yard: JAY
NAGDEV FARM, MEHSANA
Loan No: GAH02386

Loan No: GAH02286G. Name of Borrower: MR.Z KAMLESHBHAI DAHYABHAI, Co-borrower: MR.S DAHYAJI SARDAJI, Vehicle Model & YOM: BAJAJ RE CNG 4S, 2022, Regn No: GJ31X4946, Parking Yard: VAIBHAV PARKING YARD, HIMMATNAGAR

For Any queries or inspection of the vehicles, please contact us at : Indusind Bank, 401-406 Sampada Complex, Nr. Mithakhali Six Roads, Navrangpura, Ahmedabad - 380009.

Last Date 04.12.2024

પશ્ચિમ રેલવે – વકોદરા કિવિઝન સિગ્રલિંગ અને ટેલિકોમ વર્ક

નોટિસ નંબર : S&T/BRC/24-25/29/ SIG તારીખ : 29-11-2024 ભારતના રાષ્ટ્રપતિ વતી કાર્ય કરતા વરિષ્ઠ DSTE/વડોદરા ટેન્ડર નંબર : SandT\_BRC\_24-25\_29\_SIG માટે -ટેન્ડરો આમંત્રિત કરે છે. બિડર્સ તેમની મળ સંશોધિત બિડ માત્ર અંતિમ તારીખ અને સમય સધી જમા કરી શકશે. આ ટેન્ડર માટે મેન્યઅલ ઑફર્સની પરવાનગી નથી, અને આવી કોઈપણ મેન્યુઅલ ઑફર્સ પ્રાપ્ત થશે તેને અવગણવામાં આવશે. (1) કામનું નામ અને સ્થળ : "ડીસી ટ્રેક સર્કિટની સમાંતરમાં DAC પ્રદાન કરીને મિયાગામ અને મહેમદાવાદ સ્ટેશન પર ટ્રેક સર્કિટની વિશ્વસનીયતામાં સુધારો" ના કામના સંબંધમાં મિયાગામ સ્ટેશન પર ઇન્ડોર અને આઉટડોર કામો સહીત મલ્ટી સેક્શન ડિજિટલ એક્સલ કાઉન્ટર્સની સિગ્રલિંગ સામગ્રીનો આંશિક પુરવઠો, ખાઈ ખોદવી, ઇન્સ્ટોલેશન, પરીક્ષણ અને કમિશનિંગ. (2) કામની અંદાજિત કિંમત : ₹4,28,11,025.54 (3) જમા કરાવવાની બયાનની ૨કમ: ₹3,64,100.00 (4) ઈ-ટેન્ડર જમા કરવાની અને ઈ-ટેન્ડર ખોલવાની તારીખ અને સમય : 23.12.2024 @ 15:00 કલાકે અને 23.12.2024 @ 15:30 કલાકે. (5) વેબ સાઈટ વર્ણન અને માહિતીનું સ્થાન જ્યાં સંપૂર્ણ વિગતો જોઈ શકાય અને ઓફિસનું સરનામું જ્યાંથી ટેન્ડર ફોર્મ ખરીદી શકાય : સિનિયર ડિવિઝન સિગ્નલ એન્ડ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર, બીજો માળ - એનેક્સી બિલ્ડિંગ ડીઆરએમ ઓફિસ, પશ્ચિમ રેલવે, પ્રતાપનગર વડોદરા - 390004. **વેબ સાઈટ** : http://www

अमने साग्रेड 5रोः 🕤 facebook.com/WesternRly

### **Essen Speciality Films Limited**

(Formerly known as Essen Speciality Films Private Limited) Regd. Office: Survey No. 192, Plot No. A, Industrial Area,



Behind Orchev Pharma, Veraval (Shapar), Rajkot, Gujarat - 360024, India Contact: +91 98253 12701 | E-mail: compliances@essenspeciality.com Website: www.essenspeciality.com | CIN: L24224GJ2002PLC041119

### બોનસ ઈક્વિટી શેર ઈશ્યુ કરવા માટેની રેકોર્ડ ડેટની નોટિસ

આથી નોટિસ આપવામાં આવે છે કે કંપનીએ વ:પ ના ગુણોત્તરમાં (એટલે કે રૂ. ૧૦ ના ૫(પાંચ) હાલના સંપૂર્ણ પેઇડ-અપ ઇક્વિટી શેર સામે રૂ. ૧૦ ના ૧(એક) નવા સંપૂર્ણ પેઇડ-અપ ઇક્વિટી શેર) બોનસ શેર ઇશ્યૂ કરવા માટે શેરધારકોની પાત્રતા નક્કી કરવાના કેતુસર શુક્રવાર, વર્ગ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરેલ છે ("બોનસ

બોનસ શેર કંપનીના સભ્યોને ફાળવવામાં આવશે જેમના નામ રેકોર્ડ ડેટ દિવસે કંપની/ લાભદાચી માલિકની સ્થિતિ દ્વારા જાળવવામાં આવેલા સભ્યોના રજિસ્ટરમાં દેખાય છે, જે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ ( ઈન્ડિયા) લિમિટેડ પાસેથી પ્રાપ્ત થયા છે.

બોનસ શેર એકવાર ફાળવવામાં આવે તે કંપનીના મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ ઓફ એસોસિયેશનની શરતોને આધીન રહેશે અને તે તમામ બાબતોમાં સમાન ક્રમ આપશે અને કંપનીના હાલના સંપૂર્ણ પેઇડ ઇક્વિટી શેર જેવા જ અધિકારો ધરાવશે.

> એસેન સ્પેશિયાલિટી ફિલ્મ્સ લિમિટેડ વત્તી (અગાઉ એસેન સ્પેશિયાલિટી ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતી)

> > સફી પલ્લવ કિ. દોશી ચેરમેન અને હોલટાઈમ ડીરેક્ટર ડીઆઈએન: ૦૨૫૪૨૦૪૭

challenging the judgment dated 27/12/2023 and Decree dated 10/01/2024 passes by the 4th Addi. Senior Civil Judge, Ahmedabad (Rural), Navrangpura Ahmedabad in Special Civil Suit No.613/2013 and the sane having beer registered in this Court on 12/03/2024. Whereas upon hearing the Civil Application No. 2 of 2024 (For Substitut

Take notice that the Appellant above-named having presented a First Appea

No. 1024/2024 with Civil Application No.1 of 2024 to this High Court

Service) in First Appeal No. 1024 of 2024 with Civil Application No.1 of 2024, the Ionourable Court (Coram: Honourable Ms. Justice NISHA M. THAKORE) had or 29/10/2024, ordered to issue Notice by substitute service to the unserved Respondents No.2,3,4,6,7,8,9 and 11 by way of Public Notice by publication in he newspaper of vernacular language and having wide circulation in that city. Take Notice that the hearing of the First Appeal No. 1024 of 2024 with Civi Application No.1 of 2024 will take place on 19th December, 2024 at 11 AM peremptorily in this Court and if no appearance is made on your behalf, by yourself, your advocate or by someone authorised by law to act for you, it will be heard and datermined in your absence.

Witness SUNITA AGARWAL Esquire the Chief Justice at Ahmedabad aforesaid this 29th Day of October, 2024.

(H.D. Purohit) **Assistant Registrar**  the earliest.

Date: 04-12-2024

Place: Vadodara